

જેમ સ પાથ કીનસન (૧૭૫૫-૧૮૨૪) પૃથ્વી વી ઉપર આધુનિક જીવનના ઇતિહાસનો અભ્યાસ ( paleontology.) કથના અને ભૂસ્ત્ર શાસ્ત્ર તરીકે, બળયોગ, બળ કલ્પના અને શાસ્ત્રિક ધ્યાન શાસ્ત્ર તરીકે પતિ મ્નાય છે. તેણે પાથ કીનસનના યોગની શોધ ૧૮૧૭મં કથી હતી. તેણે આ યોગને "ડોલત લક્વા" ના રૂપમં વથ ણવ્યો છે. ૧૧ અપૃ થીલ તેજેમ સ પાથ કીનસનની જનમ તથીય છે તે તેને "પાથ કીનસનનો વશિ વ દવિસ" તરીકે મનવામં આવ્યો છે'.

જેમ સ પાથ કીનસન લંડનમં સામન્ય ચકિતિ સક હતે અને તેના ચકિતિ સાના સમ્ય દથ્વિયાન તેણે ૬ દથ્વીને આ નવા યોગની સાથે જોયા. તેણે આ યોગને "ડોલત લક્વા"ના રૂપમં વથ ણવ્યો અને વધતમં latin પથ્વિયાય "પક ષઘાત Agitans" તરીકે ધ્વ કથ્યો.

તેના "ડોલત લક્વા" નુ વથ ણ ચેક કસ હત અને તેણે યોગના સાથે પક ડી પાડ્યો હત તે તે પે થસદિ ધક યન સનો મ્જ જાત્મનો નધિ ણાંતચકોટે "ડોલતે લક્વા" ને પાથ કીનસનનુ નામ સુચ્યુ.

વજિ જાનને જાણીત મ્જ જાત્મના સામન્ય યોગમંથી પાથ કીનસનને આ યોગને સૌથી સામન્ય સ યતિવાળો યોગ છે તે સુચ્યુ. પાથ કીનસનનો યોગ તિયાથે થય છે, જિયાથે મ્જમં કેટલાક મ્જ જાત્મના કોષોની સાથે સમ્સયા થય છે. સાધથ યેતમ્જ જાત્મના કોષો ક મ્હતી વનુ dopamine તમ્જ મ્જના ક ભગને સંકેતમેકલાવે છે, જે તમ્જ હલનચલનાને નચિંતિ યતિકથે છે. પાથ કીનસનના દથ્વીમં ૮૦ % અથ્મા તેથી વધથે dopamine કોષોને ઇજા પહોચડે છે, અથ્મા બેજા કાથ્થસથ મ્થી જાય છે. ઘણા બધ પાથ કીનસનના યોગથી પડિાત દથ્વી તેનુ હલનચલન નચિંતિ યતિકથી શકત નથી.

□□□□□□□□□□ □□□□□□ □□□□□□ □□□□ □□□□□□□□□□ □□□□□□□□ □□□□□□ □□□□□□

- કંપન અથ્મા હાથ બહુ, પગ, જડબ અને ચ્હેથમં કંપન
- સ નાયુ નુ અકડાવુ
- હલનચલનમં ગતે ધીમે ધી
- શાસ્ત્રિક અવસથમં અસથિત

પાથ કીનસન પાંગળો અથ્મા અક ષમ કથી શકે છે. નધિ ણાતે કહે છે કે આ યોગના વ હેલા લક ષણો કદાર નાજુક અને ધીમી થય છે અને તે દથ્વી કેટલીક વાથ તેને દુથ લક ષ કથે છે અથ્મા ઉમ્ વધ યી અસથેને લીધથય છે તે કહે છે. શૂઆતમં દથ્વી બુ વધથે પડત થકી જાય છે અથ્મા યેડા અસથિ થય થય છે. તેની વાય કદાર નથ ઈ જાય છે અને તે કાથ્થ વીના ચીડાઈ જાય છે. તેનુ હલનચલન અકકડ, અસથિ અથ્મા અસામન્ય રૂપથી ધી પડી જાય છે. પાથ કીનસનના યોગનુ નદિાન કથ્વા મટે તિયા કોઈ વશિષ પથકિ ષણ નથી. વ હેલા ત્ક કામં જિયાથે લક ષણો ણ હોય છે, તિયાથે પાથ કીનસનના યોગનુ નદિાન કથ્વુ વધથે મ્શ કેલ છે. તેમં લક ષણોનો સમવેશ છે જેવા કે કંપન, લખવામં મ્શ કેલી અને ચલમં ફેચ્કાથ. જુવાન લોકોમં કદાર નદિાન ન થઈ શકે જિયા સુધી પછીના ત્ક કામં આ યોગ વૃદ્ધ ધલોકોને અસથ કથે છે.